



FIL/SE/2023-24/31
31st October, 2023

National Stock Exchange of India Limited
Listing Department
5th Floor, Exchange Plaza, C-1, Block-G,
Bandra-Kurla Complex, Bandra (E)
Mumbai-400 051
Security Symbol: **FILATEX**

BSE Limited
Listing Department
25th Floor, Pheroze Jeejeebhoy Towers
Dalal Street,
Mumbai - 400 001
Security Code: **526227**

Sub.: Publication of Unaudited Financial Results for the Quarter and Half year ended on 30th September, 2023 in Newspapers.

Dear Sir,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed newspaper cuttings of the advertisement regarding Unaudited Financial Results for the Quarter and Half year ended on 30th September 2023, approved by the Board in its Meeting held on 30th October, 2023, in the following newspapers:

1. Mumbai Edition of "The Financial Express" on 31.10.2023 in English language
2. Surat Edition of "Gujarat Mitra" on 31.10.2023 in Gujarati language
3. All Edition of "Business Standard" on 31.10.2023 in English language

You are requested to take the same on your records.

Thanking You,

Yours Faithfully,
For FILATEX INDIA LIMITED

RAMAN KUMAR JHA
Company Secretary & Compliance Officer

CORPORATE OFFICE

Bhageria House
43 Community Centre
New Friends Colony
New Delhi - 110025, India
P +91.11.26312503,26848633/44
F +91.11.26849915
E fildelhi@filatex.com

REGD. OFFICE & WORKS

S. No. 274 Demni Road
Dadra - 396193
U.T. of-Dadra & Nagar Haveli
India
P +91.260.2668343/8510
F +91.260.2668344
E filedadra@filatex.com

SURAT OFFICE

Bhageria House
Ring Road
Surat - 395002
India
P +91.261.4030000
F +91.261.2310796
E filsurat@filatex.com

MUMBAI OFFICE

321, Maker Chamber - V
Nariman Point
Mumbai - 400021
India
P +91.22.22026005/06
F +91.22.22026006
E filmumbai@filatex.com

कनारा बँक Canara Bank
 ARMI BRANCH MUMBAI
 37, Khsamalya, Opp Patkar Hall, New Marine Lines, Thackersey Marg, Mumbai - 400 020.
 Tel: (022) 22065425/30, 220654438 Email: cb2300@canarabank.com

POSSESSION NOTICE SECTION 13(4)

Whereas, the undersigned being the Authorised Officer of the Canara Bank under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 10/02/2012 calling upon the borrowers/guarantors of The Bidi Kammar Co Operative Housing Society Ltd and also the owners of the property/ surety to repay the amount mentioned in the notice, being Rs. 5,81,55,677.00 (Rupees Five Crore Eighty One Lakh Fifty Five Thousand Six Hundred Seventy Seven Only) as on 10/02/2012 together with further interest and incidental expenses, cost etc from 11/02/2012 within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken **SYMBOLIC POSSESSION** of the property described herein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 27th day of October 2023.

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, ARMI Branch, Mumbai for an amount of Rs. 28,52,53,128.97 (Rupees Twenty Eight Crore Fifty Two Lakh, Fifty Three Thousand, One Hundred Twenty Six and Ninety Seven Poise only) as on 30/09/2023 together with further interest and incidental expenses, cost etc from 01/10/2023.

The borrower's attention is invited to the provisions of Section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets

Description of the Immovable Property
 Land of area 9800 sq. mtrs situated in S.No.116/2,3,4,5 & 119/12 & 13 in village Rahanal, Tal. Bhiwandi, Dist Thane and the connected buildings

Date: 27/10/2023
 Place: Mumbai

Sd/-
 Authorised Officer,
 Canara Bank

Form No. INC-26
 [Pursuant to rule 30 to the Companies (Incorporation) Rules, 2014]
Advertisement to be published in the newspaper for change of registered office of the company from "State of Maharashtra" to "State of Karnataka".

Before the Regional Director, Western Region (Central Government).
 In the matter of Section 13 (4) of the Companies Act, 2013 and clause (a) of sub-rule (5) of rule 30 of the Companies (Incorporation) Rules, 2014

AND
 In the matter of MAVAL INDUSTRIAL AND LOGISTICS PARKS PRIVATE LIMITED
 CIN: U74999MH2021PTC361840
 Having its Registered Office at 7th Floor, Welspun House, Kamala Mills Compound, Lower Parel, Mumbai-400013, Maharashtra

Notice is hereby given to the General Public that the Company proposes to make application to the Regional Director, Western Region Bench (Central Government) under section 13 of the Companies Act, 2013 seeking confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the Special Resolution passed at the Annual General Meeting held on Friday, September 29, 2023 to enable the Company to change its Registered Office from the "State of Maharashtra" to the "State of Karnataka".

Any person whose interest is likely to be affected by the proposed change of the Registered Office of the Company may deliver either on the MCA -21 portal (www.mca.gov.in) by filing investor compliant form or cause to be delivered or send by registered post of his/her objections supported by an affidavit stating the nature of his/her interest and grounds of objection to the Regional Director, Western Region at Everest 5th Floor, 100 Marine Drive, Mumbai-400002, Maharashtra within fourteen days from the date of publication of this notice with the copy of the applicant Company at its Registered office at the address mentioned below:

7th FLOOR, WELSPUN HOUSE, KAMALA MILLS COMPOUND, LOWER PAREL, MUMBAI, CITY-400013, MAHARASHTRA

For and on the behalf of
 MAVAL INDUSTRIAL AND LOGISTICS PARKS PRIVATE LIMITED
 Sd/-
 Pankaj Kumar Bajaj
 Director
 Date: 31st October 2023
 Place: Mumbai
 DIN: 03642595

FILATEX INDIA LIMITED
 Regd Office - S.No.274, Demni Road, Dadra-396 193 (UT of Dadra & Nagar Haveli)
 Corporate Identification Number (CIN)- L17119DN1990PLC000091

Extract of Statement of Unaudited Financial Results for the Quarter and Half Year ended September 30, 2023 (Rs. In Lakhs)

S. No.	PARTICULARS	Quarter Ended			Half Year Ended		Year ended
		30.09.2023	30.06.2023	30.09.2022	30.09.2023	30.09.2022	31.03.2023
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total income from operations	1,10,784	1,06,927	1,16,342	2,17,711	2,18,671	4,30,387
2	Net Profit for the period (before tax, exceptional and/or extraordinary items)	3,152	2,396	3,408	5,548	9,256	12,208
3	Net Profit for the period before tax (after exceptional and/or extraordinary items)	3,152	2,396	3,408	5,548	9,256	12,208
4	Net Profit for the period after tax (after exceptional and/or extraordinary items)	2,310	1,762	2,516	4,072	6,855	8,990
5	Total Comprehensive Income for the period [Comprising profit for the period (after tax) and other comprehensive income (after tax)]	2,319	1,769	2,508	4,088	6,839	9,014
6	Paid up Equity Share Capital (Face value of Rs. 1/- each)	4,439	4,439	4,430	4,439	4,430	4,430
7	Earnings Per Share (Face value of Rs. 1/- each) (Not Annualised)						
	Basic :	0.52	0.40	0.56	0.92	1.54	2.02
	Diluted :	0.52	0.40	0.56	0.92	1.54	2.02

Notes:
 a) The above is an extract of the detailed format of results for Quarter and Half year ended September 30, 2023 filed with the stock exchanges under regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Yearly financial results are available on Company's Website www.filatex.com and on the website of the Stock Exchanges www.nseindia.com and www.bseindia.com.
 b) The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on October 30, 2023 and have undergone "Limited Review" by the Statutory Auditor's of the Company. The financial results have been prepared in accordance with Indian Accounting Standards (IND-AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 and relevant amendment rules thereafter.

On behalf of the Board of Directors
MADHU SUDHAN BHAGERIA
 CHAIRMAN & MANAGING DIRECTOR
 DIN : 00021934

Place : New Delhi
 Date : October 30, 2023

CLASSIFIEDS
 OTHER CLASSIFIEDS
 CHANGE OF NAME
 CHANGE OF NAME

L. KEREMUT RAMESH BHAT, S/o Keremut Sripathy Bhat, residing at House No. 24-124, Keremut, Moodubettu, Opp: Anganavadi, Kodavoor Village, Krodashrama Post, Udipi Taluk and District - 576106, Karnataka vide affidavit dated 30-10-2023 sworn before Notary Muralhari K., Udipi here by say that all the names "RAMESH BHAT K.", "KEREMUT RAMESH BHAT" and "RAMESH BHAT" pertain to one and the same person i.e., myself only.

0120021213-1-1

"IMPORTANT"
 While care is taken prior to acceptance of advertising copy it is not possible to verify its contents. The Indian Express Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or publications. We therefore recommend that readers make necessary inquiries before sending any notices or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever. Registered letters are not accepted in response to box number advertisements.

For Advertising in TENDER PAGES
 Contact **JITENDRA PATIL**
 Mobile No.: 9029012015
 Landline No.: 67440215

INVENT ASSETS SECURITISATION & RECONSTRUCTION PRIVATE LIMITED
 Suite B, Ground Floor, Bakhtawar, 225, Nariman Point, Mumbai - 400021 Ph: 022 - 22801516

APPENDIX-IVA [See proviso to rule 8 n/w rule 9]
SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

PUBLIC NOTICE - AUCTION CUM SALE OF IMMOVABLE PROPERTIES ("SECURED ASSETS") OF PURNANDU JAIN HUF AND MRS. ANUPAMA JAIN & MR. PURNANDU JAIN (since deceased) ("BORROWER") FOR THE RECOVERY OF THEIR DUES UNDER RULE 8 R/W RULE 9 OF THE SECURITY INTEREST ENFORCEMENT RULES, 2002

Whereas under section 13(2) of the "Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SARFAESI Act), the Authorised Officer of Invent Assets Securitisation & Reconstruction Pvt. Ltd. (INVENT) acting in its capacity as trustee of INVENT/1516/S46 Trust had issued demand notice dated 18.01.2021 calling upon the Borrowers Purnandu Jain HUF, its Guarantors, Mortgagees, Co-parceners & Legal heirs of Mr. Purnandu Jain (since deceased) for the recovery of Rs. 22,54,27,946.61/- (Rupees Twenty Two Crores Fifty Four Lakhs Twenty Seven Thousand Nine Hundred Forty Six and Sixty One Paise Only) and Mrs. Anupama Jain, its Guarantors & Mortgagees & Legal heirs of Mr. Purnandu Jain (since deceased) a sum of Rs. 32,12,95,989.53/- (Rupees Thirty Two Crores Twelve Lakhs Ninety Five Thousand Nine Hundred Eighty Nine and Fifty Three Paise Only) respectively as on 15th January, 2021 along with further interest and incidental expenses and costs within 60 days from the date of the said notice.

AND WHEREAS, the Borrowers/Guarantors/Mortgagees/Co-parceners/legal heirs of Mr. Purnandu Jain (since deceased) having failed and neglected to repay the dues as per demand notice, the Authorised Officer of INVENT has taken over the Physical Possession of its mortgaged property u/s 13(4) of SARFAESI Act on 18th October, 2023.

Notice is hereby given to the public in general that Invent Assets Securitisation & Reconstruction Private Limited (INVENT) is an Asset Reconstruction Company duly registered with Reserve Bank of India under section 3 of the provisions of Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (SARFAESI Act), acting in its capacity as a Trustee of "INVENT/1516/S46 TRUST", who has acquired the entire outstanding debts of the Borrower Purnandu Jain HUF and Mrs. Anupama Jain & Mr. Purnandu Jain (since deceased) from Central Bank of India along with all the rights, title and interests vested therein in underlying security under section 5 of the SARFAESI Act vide registered Assignment Agreement dated 26th November, 2015 duly registered with the Sub Registrar Mumbai. The security interest in the said financial assets now stand assigned/ transferred to and vested in favour of INVENT.

Offers are now invited by undersigned from intending purchasers/bidders in sealed envelopes/covers for purchase of the secured assets as described herein below for sale on "as is where is basis", "as is what is basis" and "no recourse basis under the provisions of Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and Security Interest (Enforcement) Rules 2002. The General Public is invited to participate in bid either personally or through their duly authorised agent.

1.	Name of the Secured Creditor	Invent Assets Securitisation & Reconstruction Private Limited (INVENT), acting in its capacity as a Trustee of "INVENT/1516/S46 Trust".
2.	Name of the Borrowers	Purnandu Jain HUF Mrs. Anupama Jain & Mr. Purnandu Jain (Since Deceased)
3.	Name of the Mortgagees	Purnandu Jain HUF Mrs. Anupama Jain & Mr. Purnandu Jain (Since Deceased)
4.	Name of the Guarantors	1. Mrs. Anupama Jain 2. Mr. Vaibhav Jain 3. Mr. Purnandu Jain (Since deceased)
5.	Total Liabilities	Purnandu Jain HUF - Rs. 22,54,27,946.61/- (Rupees Twenty Two Crores Fifty-Four Lakhs Twenty-Seven Thousand Nine Hundred Forty-Six and Sixty-One Paise Only) AND Mrs. Anupama Jain & Mr. Purnandu Jain (now deceased) - Rs. 32,12,95,989.53/- (Rupees Thirty-Two Crores Twelve Lakhs Ninety-Five Thousand Nine Hundred Eighty-Nine and Fifty-Three Paise Only) as on as on 15th January, 2021, with future interest at contractual rate till the date of recovery/realisation and other expenses/costs thereon. Hence total liabilities amount to Rs. 54,67,23,936.14/- (Rupees Fifty-Four Crores Sixty-Seven Lakhs Twenty-Three Thousand Nine Hundred and Thirty-Six and Fourteen Paise only)
6.	Last Date & Time for submission of bid	01st December, 2023 up to 02:00 p.m.
7.	Address at which the tender to be Submitted	Bakhtawar, Suite 'B', Ground Floor, Backbay Reclamation Scheme Block III, 229, Nariman Point, Mumbai - 400 021.
8.	Date & Time of Bid Opening	01st December, 2023 up to 04:00 p.m.
9.	Place of Auction	Bakhtawar, Suite 'B', Ground Floor, Backbay Reclamation Scheme Block III, 229, Nariman Point, Mumbai - 400 021.
10.	Description of the Immovable Property/ Secured Asset	Flat No. 3401A/B/C & Flat No. 3402A/B/C (admeasuring 5763 sq. ft. - super build-up), Oberoi Sky Heights Building No. 2, 34th Floor, Plot No. 120, Lokhandwala Complex, Andheri (West), Mumbai - 400053 together with 4 car parking space. Both the Flats are merged and will be sold as one combined Flat.
11.	Reserve Price	Rs. 29,31,00,000/- (Rupees Twenty-Nine Crores Thirty-One Lakhs Only)
12.	Earnest Money Deposit (EMD)	10% of the Reserve Price i.e., Rs. 2,93,10,000/- (Rupees Two Crores Ninety-Three Lakhs and Ten Thousand Only)
13.	Inspection Date and Time	09th November, 2023 between 11.00 am to 05.00 pm.

For further details, contact Mr. Ankit Shetty, Authorised Officer, Invent Asset Securitisation and Reconstruction Company Ltd, at above mentioned address. Phone No: 9920587626. Email id: ankit.shetty@inventarc.com
 For detailed terms and conditions of the sale, please refer to the link provided on www.inventarc.com Secured Creditor's (INVENT) website.

Date: October 30, 2023
 Place: Mumbai

Sd/-
 Authorised Officer
 Invent Assets Securitisation & Reconstruction Private Limited (acting in its capacity as trustee of INVENT/1516/S46 Trust)

THE BUSINESS DAILY.

FINANCIAL EXPRESS

FOR DAILY BUSINESS.

financialexpress.com

DEMAND NOTICE
 Branch Office: ICICI BANK LTD., ICICI BANK TOWERS, BANDRA-KURLA COMPLEX, BANDRA (EAST), MUMBAI 400 051. Phone No. 022 66962422.

DEMAND NOTICE

Whereas the Authorised officer of ICICI BANK LIMITED ("the Bank") under the Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 ("SARFAESI Act") has in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued, Demand Notice dated October 17, 2023 under section 13(2) of the said Act, calling upon the Borrower - M/s Mex Lifecare LLP, having its registered office at Flat No. 1701, Evelina, Hiranandani Estate, G.B. Road, Patli Pada, Thane 400607, Maharashtra, India and Guarantors/ Security providers, (1) Mr. Rajkumar Kucheria (2) Mr. Akshay Kucheria and (3) Ms. Ujjwala Kucheria all residing at Flat No. 1701, Evelina, Hiranandani Estate, G.B. Road, Patli Pada, Thane 400 607, Maharashtra (4) Mr. Chandrashekar Kucheria and (5) Ms. Sangeeta Kucheria both residing at F-2, 301, Valley Tower Annex, Chitlars, Manpada, Thane 400 610, Maharashtra (6) Mr. Hardik Ashwin Ramdhia residing at Flat No B-601, Padmavati Nagar, Dumping Road, Nr. Check Naka, Mulund (West) Mumbai 400 080, Maharashtra. (7) Mr. Amit Ashok Bambaria residing at 230, Kalani Nagar, Airport Road, Brijasan Road, Indore 452 005, Madhya Pradesh (8) M/s Pharmex Healthcare registered office at T-117-120, Jai Mata Di Compound, Thane- Bhiwandi Rd, village Kalher, Bhiwandi 421 302, Maharashtra to pay the amount mentioned in the said Demand Notice being 45,87,850.68 (Forty Five Lakhs Eighty Seven Thousand Eight Hundred and Fifty Rupees and Sixty Eight Paise Only), calculated as on October 05, 2023 together with further interest at the contractual rate on the aforesaid amount and incidental expenses, costs, charges etc. within 60 days from the date of the said Notice(s). Please note that due to non-payment of dues, your Account has already been classified as Non-Performing Assets (NPA) as on June 29, 2023 in accordance with the directions or guidelines relating to assets classifications issued by the Reserve Bank of India. The demand notice(s) dated October 17, 2023 sent by registered AD / Speed Post has / have been returned undelivered.

The Borrower / Guarantors / Security Providers, are prohibited under Section 13(13) of the SARFAESI Act to transfer the aforesaid assets, whether by way of sale, lease or otherwise without the prior written consent of the Bank. Any contravention of the provisions of the SARFAESI Act will render the Borrower / Guarantors / Security Providers responsible for the offence and liable to the penalty in accordance with the SARFAESI Act, 2002.

DESCRIPTION OF THE SECURED ASSETS / PROPERTIES TO BE ENFORCED

A) Short particulars of movable Assets mortgaged as and by way of First and exclusive charge:
 * The whole of the Security provider's stocks of raw materials, cash in hand, goods-in-process, semi-finished and finished goods, consumable stores and spares and such other movables, including book debts, bills, whether documentary or clean, both present and future, whether in the possession or under the control of the Security provider or not, whether now lying loose or in cases or which are now lying or stored in or about or shall hereafter from time to time during the continuance of these presents be brought into or upon or be stored or be in or about all the Security provider's factories, premises and godowns situated at India or wherever else the same may be or be held by any party to the order or disposition of the Security provider or in the course of transit or on high seas or on order or delivery (the "Current Assets", which expression shall, as the context may permit or require, mean any or each of such Current Assets).
 * The whole of the Security provider's moveable properties (save and except current assets) including its movable plant and machinery, machinery spares, tools and accessories, non-trade receivables and other movables, both present and future, whether in the possession or under the control of the Security provider or not, whether installed or not and whether now lying loose or in cases or which are now lying or stored in or about or shall hereafter from time to time during the continuance of these presents be brought into or upon or be stored or be in or about all the Borrower's factories, premises and godowns situated at Mumbai or wherever else the same may be or be held by any party to the order or disposition of the Borrower or in the course of transit or on high seas or on order or delivery (the "Moveable Properties", which expression shall, as the context may permit or require, mean any or each of such Moveable Properties).
 * All amounts owing to, and received and/or receivable by the Borrower and/or any person on its behalf, all book debts, all cash flows and receivables and proceeds arising from/in connection with, and all rights, title, interest, benefits, claims and demands whatsoever of the Borrower in, to or in respect of all the aforesaid assets, including but not limited to the Borrower's cash-in-hand, both present and future (the "Receivables", which expression shall, as the context may permit or require, mean any or each of such Receivables).

I. RCC Godown bearing no. T/117, T/118, T/119 and T/120 on First floor totally admeasuring 8586.00 sq.ft. along with undivided common interest in the land beneath the said premises bearing survey No. 57, Hissa No 13 out of Consolidated NA land comprising of Survey No. 57/2, 57/11, 57/12/3A, 57/12/C, 58/3, 58/4, 58/5, 58/8, 58/11, 58/14, 58/16, 59/2A totally admeasuring 15340 sq.mt situate lying and being at Mouje/Kalher Taluka Bhiwandi/Dist-Thane, together with all the buildings and structures thereon, fixtures, fittings and all plant and machinery attached to the earth or permanently fastened to anything attached to the earth, both present and future owned by M/s Pharmex Healthcare.

Date: 31.10.2023
 Place: Mumbai

Authorized Officer
 ICICI BANK LIMITED

DEMAND NOTICE
 Branch Office: ICICI Bank Ltd., Icici Bank Towers, Bandra-Kurla Complex, Bandra (east), Mumbai 400 051. Phone No. 022 66962422.

DEMAND NOTICE

Whereas the Authorised officer of ICICI BANK LIMITED ("the Bank") under the Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 ("SARFAESI Act") has in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued, Demand Notice dated October 18, 2023 under section 13(2) of the said Act, calling upon the Borrower - M/s Home Zone Metals Pvt. Ltd. (Erstwhile Home Zone Stainless Pvt. Ltd.) registered office at Dr. Annie Besant Road, Worli D1 Ground Floor, Plot No 100, Sarjan Plaza, Mumbai- 400 018 Maharashtra and Guarantors/ Security providers Mr. Jitendra Agarwal residing at Dr. Annie Besant Road, Worli D1 Grd Floor Plot No 100, Sarjan Plaza, Mumbai- 400018 Maharashtra and alternate address The View, 3rd Floor, 165 Dr Annie Besant Road, Opp. TATA showroom, Worli, Mumbai 400 018 to pay the amount mentioned in the said Demand Notice being Rs. 20,30,55,401.30 (Rupees Twenty Crores Thirty Lakhs Fifty Five Thousand Four Hundred One and Paise Thirty only) calculated as on October 10, 2023 together with further interest at the contractual rate on the aforesaid amount and incidental expenses, costs, charges etc. within 60 days from the date of the said Notice(s). Please note that due to non-payment of dues, your Account has already been classified as Non-Performing Assets (NPA) as on August 28, 2023 in accordance with the directions or guidelines relating to assets classifications issued by the Reserve Bank of India.

This Notice is hereby given to the Borrower / Guarantors / Security providers to pay to the Bank within 60 days from the date of publication of this Notice, the amount indicated herein above dues as on date together with further interest at contractual rates on the aforesaid amount and incidental expenses, costs, charges, etc. The debt due to the Bank is a debt secured against the below mentioned property and the same is mortgaged as security interest created in favour of the Bank.

If the Borrower / Guarantors / Security Providers fails to make payment to the Bank as aforesaid, then the Bank shall proceed against the secured assets mentioned below under Section 13(4) of the SARFAESI Act and the application rules entirely at the risks of the concerned Borrower/ Guarantors / Security Providers, as to the costs and consequences. The Borrower/ Guarantors/ Security providers can collect the original notice and complete details from the Authorized Officer.

The Borrower/ Guarantors/ Security Providers, are prohibited under Section 13(13) of the SARFAESI Act to transfer the aforesaid assets, whether by way of sale, lease or otherwise without the prior written consent of the Bank. Any contravention of the provisions of the SARFAESI Act will render the Borrower/ Guarantors/ Security Providers responsible for the offence and liable to the penalty in accordance with the SARFAESI Act, 2002.

DESCRIPTION OF THE SECURED ASSETS / PROPERTIES TO BE ENFORCED

A) Short particulars of movable assets mortgaged as and by way of exclusive charge:
 I. The whole of the Hypothecator's stocks of raw materials, goods-in-process, semi-finished and finished goods, consumable stores and spares and such other movables, including book debts, bills, whether documentary or clean, both present and future, whether in the possession or under the control of the Hypothecator or not, whether now lying loose or in cases or which are now lying or stored in or about or shall hereafter from time to time during the continuance of these presents be brought into or upon or be stored or be in or about all the Hypothecator's factories, premises and godowns situated at Mumbai, Maharashtra or wherever else the same may be or be held by any party to the order or disposition of the Hypothecator or in the course of transit or on high seas or on order or delivery (the "Current Assets", which expression shall, as the context may permit or require, mean any or each of such Current Assets).
 ii. The whole of the Hypothecator's moveable properties (save and except current assets) including its movable plant and machinery, machinery spares, tools and accessories, non-trade receivables and other movables, both present and future, whether in the possession or under the control of the Hypothecator or not, whether installed or not and whether now lying loose or in cases or which are now lying or stored in or about or shall hereafter from time to time during the continuance of these presents be brought into or upon or be stored or be in or about all the Hypothecator's factories, premises and godowns situated at Maharashtra or wherever else the same may be or be held by any party to the order or disposition of the Hypothecator or in the course of transit or on high seas or on order or delivery (the "moveable properties", which expression shall, as the context may permit or require, mean any or each of such moveable properties).
 iii. All amounts owing to, and received and/or receivable by the Hypothecator and/or any person on its behalf, all book debts, all cash flows and receivables and proceeds arising from/in connection with business, and all rights, title, interest, benefits, claims and demands whatsoever of the Hypothecator in, to or in respect of all the aforesaid assets, including but not limited to the Hypothecator's cash-in-hand, both present and future (the "Receivables", which expression shall, as the context may permit or require, mean any or each of such Receivables).

B) Short particulars of immovable properties mortgaged with ICICI Bank:
 i. Office no. G-01/A adms 62.875 sq. mtrs. (carpet area) in the basement of left wing of the building known as 'Sarjan Plaza Condominium' situated on All piece and parcel of land bearing CTS Nos. 1/1538, 2/1538 of Lower Parel Division, Taluka: Mumbai in the registration district and sub-district of Mumbai city, situate, lying and being at 100, Dr. Annie Besant Road, Worli, Mumbai- 400 001.
 ii. Office no. G-01/B adms 62.875 sq. mtrs. (carpet area) in the basement of left wing of the building known as 'Sarjan Plaza Condominium' situated on All piece and parcel of land bearing CTS Nos. 1/1538, 2/1538 of Lower Parel Division, Taluka: Mumbai in the registration district and sub-district of Mumbai city, situate, lying and being at 100, Dr. Annie Besant Road, Worli, Mumbai- 400 001.
 iii. Office no. G-01/C adms 53.60 sq. mtrs. (carpet area) in the ground of left wing of the building known as 'Sarjan Plaza Condominium' situated on All piece and parcel of land bearing CTS Nos. 1/1538, 2/1538 of Lower Parel Division, Taluka: Mumbai in the registration district and sub-district of Mumbai city, situate, lying and being at 100, Dr. Annie Besant Road, Worli, Mumbai- 400 001.
 iv. Office no. G-01/D adms 96.43 sq. mtrs. (carpet area) in the basement of left wing of the building known as 'Sarjan Plaza Condominium' situated on All piece and parcel of land bearing CTS Nos. 1/1538, 2/1538 of Lower Parel Division, Taluka: Mumbai in the registration district and sub-district of Mumbai city, situate, lying and being at 100, Dr. Annie Besant Road, Worli, Mumbai- 400 001.
 Together with all the buildings and structures thereon, fixtures, fittings and all plant and machinery attached to the earth or permanently fastened to anything attached to the earth, both present and future.

Date: 31.10.2023
 Place: Mumbai

Authorized Officer
 ICICI BANK LIMITED

THE BUSINESS DAILY.

FINANCIAL EXPRESS

FOR DAILY BUSINESS.

financialexpress.com

પોજ ૩

રોનાલ્ડોએ સુપરસ્ટાર સલમાન ખાનને ઓળખ્યો નહીં



મુંબઈ: તા. ૩૦: બોલિવૂડના 'ગોડ ફાદર' કહેવાતા સલમાન ખાન માટે આખી દુનિયા પાગલ છે. તે વખતે પણ ખાન છે ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉલ્લુક હોય છે, પરંતુ કદાચ ફૂટબોલ લેવેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ભાઈજાનને ઓળખતા નથી. ખરેખર, ગઈ કાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો, જે હવે રાજીની વિષય બન્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રોનાલ્ડો સલમાન ખાનને ઓળખતો નથી અને આગળ નીકળી જાય છે. તે વખતે ટાલેવનીય છે કે બંને સ્ટાર્સ ટાલેવન ફ્યુચરી અને ફ્રાન્સિસ એનગાનોઈ વચ્ચેની એમએમએ મેચ જોવા માટે સાઈદી અરેબિયા ગયા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. મીસ વલ્દ્યા છે. ઘણા લોકો સભ્યના ખાનની મજા લેતાં અને મીસ પર મીસ શેર કરતાં જોવા મળે છે.

અશોક ગોહલોતના પુત્ર વૈભવ ઈડી સમક્ષ હાજર થયા, ૧૬ નવેમ્બરે ફરી બોલાવાયા

નવી દિલ્હી: તા. ૩૦ (પીટીઆઈ) રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગોહલોતના પુત્ર વૈભવ ગોહલોત સોમવારે વિદેશી હુંડરિમાણ ઉલ્લંઘન કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ રિસ્કોરેટ (ઈસી) સમક્ષ હાજર થયા હતા અને લગભગ આઠ કલાક સુધી તેમની પૂછપરછ કરીને નિવેદન નોંધવામાં આવ્યું હતું.



ફેરલ એજન્સીએ ગયા અઠવાડિયે ૪૩ વર્ષીય વૈભવ ગોહલોતને સમન્સ જારી કરીને તેને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (કેમ) ની જોગવાઈઓ હેઠળ અહીં એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત તેના મુખ્યાલયમાં કેસના તપાસ-અધિકારી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. ગોહલોત સવારે ૧૧ વાગ્યાની આસપાસ ઈડી ઓફિસ પહોંચ્યા હતા. વૈભવ ગોહલોત રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી)ના સભ્ય પણ છે.

સમન્સ બાદ વૈભવે કહ્યું હતું કે, "એજન્સી તેમની સામે ૧૦-૧૨ વર્ષ જૂના ખોટા આરોપો મૂકી રહી છે અને તે પછી યૂટીડીની તારીખો જાહેર થયા પછી." ૨૦૦ સભ્યોની રાજસ્થાન વિધાનસભા માટે ૨૫ નવેમ્બરના રોજ મતદાન થશે અને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાની યૂટીડીનાં પરિણામો સાથે ૩ ડિસેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવશે.

શંકાસ્પદ એજન્ટો દક્ષિણ એશિયામાં ગેરકાયદે યુકે વિઝા એપોઈન્ટમેન્ટનો બહોળો વેપાર કરી રહ્યા છે

લંડન: તા. ૩૦ (પીટીઆઈ): યુકેની એક મીડિયા તપાસમાં જાણવા મળ્યું છે કે, કેટલાક શંકાસ્પદ એજન્ટો દક્ષિણ એશિયામાં ગેરકાયદે વિઝા એપોઈન્ટમેન્ટનો વેપાર કરી રહ્યા છે, જે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં વિદ્યાર્થીઓ અને કામદારો પાસેથી એવી સેવાઓ માટે વધુપડતાં નાણાં વસૂલે છે, જે મક્ત હોવી જોઈએ. રવિવારે 'ધ ઓર્ગાઈવર' અખબાર અનુસાર, દક્ષિણ એશિયાના કેટલાક ભાગોમાં દલાલો આ દેશોમાં સોશિયલ મીડિયા મેસેજિંગ સેવાઓ પર બાયોમેટ્રિક એપોઈન્ટમેન્ટ માટે ૮૦૦ જીબીપી (આશરે રૂ. ૮૦,૦૦૦) સુધીનો ચાર્જ વસૂલ કરે છે. આ સમસ્યા પાકિસ્તાનમાં સૌથી ખરાબ હોવાનું માનવામાં આવે છે જ્યાં તપાસમાં જાણવા મળ્યું છે કે એજન્ટો દ્વારા વિઝા એપોઈન્ટમેન્ટ સિસ્ટમનો દુરુપયોગ છેલ્લા વર્ષથી નોંધપાત્ર રીતે વધ્યો છે. યુકે સ્થિત ઈન્ટિસ્ટ્રટ્સ ફોર લ્યુમન રાઈટ્સ એન્ડ બિઝનેસ ખાતે સ્થળાંતર કામદારોના કાર્યક્રમ માટે દક્ષિણ એશિયાના સંયોજક રાકેશ રંજને અખબારને જણાવ્યું હતું કે, "તે એક મોટો મુદ્દો છે. તે યુકે આવવા માંગતા લોકોનાં દેવામાં વધારો કરે છે." તાજેતરમાં નવી દિલ્હીથી વિઝા માટે અરજી કરતી વખતે રંજને એક એજન્ટે ૫૦૦ જીબીપીની સમક્ષ કિંમત જણાવી હતી - સરકારી ફી સિવાય - જેણે તેને તેના દસ્તાવેજોની વ્યવસ્થા કરવા અને એપોઈન્ટમેન્ટ બુક કરવામાં મદદ કરવાની ઓફર કરી હતી.

કોવિડ રસીકરણથી ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી: આઈસીએમઆર

નવી દિલ્હી: તા. ૩૦ (પીટીઆઈ): ઈન્ડિયન કોવિડ રિસર્ચ સેન્ટર (આઈસીએમઆર) દ્વારા હાથ પડવામાં આવેલા એક અભ્યાસ મુજબ, કોવિડ-૧૯ રસીકરણથી ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જે પરિબળો આવી સંભાવનાઓ વધારી છે તેમાં ભૂતકાળમાં (આઈસીએમઆર) દ્વારા હાથ પડવામાં થયેલા સમય પહેલાં જ વધુપડતો દારૂ પીવો અને તીવ્ર શારીરિક પ્રવૃત્તિ જેવી કેટલીક વર્તણૂકોનો સમાવેશ થાય છે.

મહી શાખા : બજાર, મહી-૩૮૪૩૪૦, તા.ખારાબેલી, જી.સુરત. ફોન નં.૦૨૬૨૨-૨૪૨૬૬ (D) ૨૪૨૦૩૨
email : madhi@bankofbaroda.com

સંકેતિક કમ્પ્લેક્સ નોટીસ (સાચી મિલકત)

નીચે સહી કરનાર બેંક ઓફ બારોડા ના અધિકૃત અધિકારીએ સિક્યુરિટાઈઝેશન એન્ડ રિફ્રેન્ડરિંગ ઓફ ડ્રાઈવિંગ લાઇસન્સ એન્ડ એન્ફોર્સમેન્ટ એક્ટ સિક્યુરિટી ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ૨૦૦૨ ના ૩૩૭ (૨) ક્લોઝ ડેલિવરી ડેટ તેમને મળેલ સત્તાની અંતર્ગત ૦૮.૦૮.૨૦૨૩ ના રોજ ઈન્ડિયન નોટીસ બજારીને દેવાદારો શ્રી મીના સુવિનયન યાદવ અને શ્રીમતી કાજલ મનિષ યાદવ નોટીસમાં દર્શાવેલ રકમ રૂ.૧૬,૬૨,૩૨૦.૪૨ (અંક ૩૨) સાથે જાણ કરવામાં આવી છે. આ નોટીસ પ્રતિબંધિત તારીખ થી ૬૦ દિવસની અંદર પરત ચૂકવી દેવાનું જણાવ્યું હતું.

દેવાદાર આ રકમ પરત ચૂકવવામાં કસ્ટરવાર ઇલાં હોવાથી દેવાદારો અને સામાન્ય રીતે જાહેર જનતાને અહીં નોટીસ આપવામાં આવે છે કે, નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ આ ધારાની કલમ ૧૩ની પેઠા કલમ (૨) સિક્યુરિટી ઈન્સ્ટ્રુમેન્ટ એન્ફોર્સમેન્ટ એક્ટ ૨૦૦૨ ના ૩૩૭ (૨) ક્લોઝ ડેલિવરી ડેટ તેમને મળેલ અધિકાર અનુસાર તારીખ ૨૫મી ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ આ સંપત્તિનો સંકેતિક કમ્પ્લેક્સ સંભાળી લીધેલ છે.

આસ કરીને દેવાદાર અને સામાન્ય જાહેર જનતાને અહીં વેતનથી આપીને આ સંપત્તિ સાથે કોઈ પણ મુશ્કેલી વ્યવહાર કે સોંપા ન કરવાનું જણાવવામાં આવે છે. આ સંપત્તિ સાથે કોઈપણ કસ્ટરનો વ્યવહાર સંચાલનમાં આવશે તો તે બેંક ઓફ બારોડાની રકમ રૂ.૧૬,૬૨,૩૨૦.૪૨ તેના ઉપરના વ્યાજ નો અધિકાર રહેશે.

દેવાદારનાં પાંચ દેવાનું કે તેમને નિયમ ૧૩ની પેઠા કલમ (૮) ની જોગવાઈ મુજબ સુરક્ષિત મિલકતનો ડ્રોવેરવા માટે પુરતો સમય આપેલ છે.

સ્વાચી મિલકતનું વર્ણન

તમામ બાબ અને હિસ્સો ધરાવતી સ્વાચી મિલકત એવું રેસીડન્સી સ્થિત પ્લોટ નં.૨૧૫ (મંજૂર થયેલ વાન મુજબ પ્લોટ નં.૨૧૫/૫૦) (કે.જે.પી. મુજબ બ્લોક નં.૧૪૫) જેનું ક્ષેત્ર ૬૬.૯૨ ચો.મી. વાને ૦.૦૦૦ ચો.પર. જે જમીનમાં ૪૨.૨૫ ચો.મી.માં આવેલ રોડ અને સીબીની વાન વચ્ચેનાં વચાલેલ હિસ્સા સહિતનાં બાંધકામ રેવન્યુ ચર્ચ નં.૧૨૮, બ્લોક નં.૧૪૬, રેવન્યુ ચર્ચ નં.૧૩૦, બ્લોક નં.૧૪૬/૧, રેવન્યુ ચર્ચ નં.૧૩૧/૧, ૧૩૧/૨, બ્લોક નં.૧૪૬, રેવન્યુ ચર્ચ નં.૧૩૨, બ્લોક નં.૧૪૬ અને રેવન્યુ ચર્ચ નં.૧૩૩, બ્લોક નં.૧૪૬/૨ જેનું ક્ષેત્ર ૩૪૮૮.૦૫ ચો.મી.વાળી મોજે ત્રણ સાંપળી, તા.પરિણામ, જી.સુરત પાલે આવેલ જમીન ઉપર વસેલ છે. જેની વાસ્તુક્રિયા : ઉત્તર નં. ૫૦૪ નં. ૨૧૬, દક્ષિણ તરફ : પ્લોટ નં. ૨૧૬, પૂર્વ તરફ : પ્લોટ નં. ૨૦૮, પશ્ચિમ તરફ : સોસાયટીનો રોડ આવેલ છે.

તારીખ : ૨૫.૧૦.૨૦૨૩ સ્થળ : સુરત અધિકૃત અધિકારી, બેંક ઓફ બારોડા



રશિયાના દાગેસ્તાનના એક એરપોર્ટ પર ઘરરાયેલથી વિમાનના આગમન વખતે ટોળાનો હુમલો

સ્થાનિક મુસ્લિમોએ યહુદીઓના આગમનનો વિરોધ કરીને વિમાનમાંથી ઉતરી રહેલા મુસાફરો પર હુમલાનો પ્રયાસ કર્યો, અલ્લાહુ અકબરના નારા પણ પોકાર્યા

પાટનગર માખાજકલાના એરપોર્ટ પર ઘરરાયેલના તેલચીવ શહેરથી આવેલ એક વિમાનના લેન્ડિંગ પછી એક તોફાની ટોળું ઘરરાયેલથી મુસાફરો પર હુમલો કરવા માટે ઘસી ગયું હતું. પોલીસ સાથે ટોળાની અથડામણમાં ૨૦ કરતા વધુ લોકોને ઘણા ઘાયલો અને ૬૦ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સ્થાનિક સમય પ્રમાણે રવિવારે રાત્રે તેલચીવથી રશિયાની ૨૬ વેન્ડ એરલાઇનનું એક વિમાન આવી પહોંચ્યું ત્યારે સ્થાનિક મુસ્લિમોનું એક ટોળું એરપોર્ટમાં પ્રવેશીને તેના ટર્મિનલ તરફ ઘસી ગયું હતું. તેઓ પેલેસ્ટાઇનના દુર્ઘટકાવાતા હતા અને યહુદીઓની શોધ ચલાવતા હતા. કેટલાકે તો અલ્લાહુ અકબરના નારા પણ પોકાર્યા હતા. તેમણે વિમાનમાંથી ઉતરતા મુસાફરોને પરત જતા રહેવા માટે કહેલી બૂમો પાડી હતી અને બાળકોને મારનાર આ દેશમાં આવવાનું નથી અને અમે યહુદી શરણાર્થીઓના વિરુદ્ધમાં છીએ એવું લખેલા બેનર દર્શાવ્યા હતા. આ હુમલાને કારણે એરપોર્ટ પર ગભરાટ અને નાસભાગ મચી ગઈ હતી અને બાળકો રડવા લાગ્યા હતા. પોલીસે ટોળાને અટકાવતા અથડામણ સર્જઈ હતી અને પોલીસ અને નાગરિકો મળીને ૨૦થી વધુને ઘણા ઘાયલો લઈ બેમાંથી બેની ઘણા ગંભીર ગણાવાયા છે. આ ઘટના પછી રશિયાન પ્રમુખ વ્લાદીમીર પુટિને સુરક્ષા વિભાગના અને કાયદા અમલીકરણ વિભાગના ટોચના અધિકારીઓનો આજે સોમવારે બેઠક ખોલાવી હતી.

બેંગલુરુમાં ગેરેજમાં આગ લાગતાં ત્યાં પાર્ક કરેલી ૨૨ ખાનગી બસો બળીને ખાખ

બેંગલુરુ: તા. ૩૦ (પીટીઆઈ): સોમવારે અહીંના એક ગેરેજમાં આગ લાગ્યા બાદ પાર્ક કરેલી ૨૨ ખાનગી બસોને બળીને ખાખ થઈ ગઈ હતી. એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, વીરભદ્ર નગરમાં ગેરેજમાં પાર્ક કરેલી બસોમાંથી એક બસમાં વેલિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આગ ફાટી નીકળી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "પ્રાથમિક તપાસ મુજબ, અમને શંકા છે કે વેલિંગ મશીનમાંથી નીકળેલા તણખાને આગ ગેરેજમાં પાર્ક કરેલી અન્ય બસોમાં ફેલાઈ ગઈ હતી અને તેને ભારે નુકસાન થયું હતું."



HDFC BANK એચડીએફસી બેંક લિમિટેડ પર્ગેશન નોટિસ

પ્રાચલ : એચડીએફસી બેંક લિમિટેડ, ટ્રાયલેન્ડ, રેસકોર્સ, વડોદરા-૩૯૦૦૦૭, ફોન : ૦૨૬-૨૪૨૦૬૬૬૬

એચડીએફસી બેંક લિમિટેડના (ખૂતકાળમાં એચડીએફસી લિ., જેનું નામદાર એન્સીએલટી મુંબઈ ના તારીખ ૧૭ માર્ચ, ૨૦૨૩ના આદેશ મુજબ મંજૂર થયેલ એકીકરણ યોજના અનુસાર એચડીએફસી બેંક લિમિટેડ સાથે એકીકરણ થયેલ છે) અધિકૃત અધિકારીઓને સિક્યુરિટાઈઝેશન એન્ડ એન્ફોર્સમેન્ટ એક્ટ ૨૦૦૨ ના ૩૩૭ (૨) ક્લોઝ ડેલિવરી ડેટ તેમને મળેલ સત્તાની અંતર્ગત ૦૮.૦૮.૨૦૨૩ ના રોજ ઈન્ડિયન નોટીસ બજારીને દેવાદારો શ્રી મીના સુવિનયન યાદવ અને શ્રીમતી કાજલ મનિષ યાદવ નોટીસમાં દર્શાવેલ રકમ રૂ.૧૬,૬૨,૩૨૦.૪૨ (અંક ૩૨) સાથે જાણ કરવામાં આવી છે. આ નોટીસ પ્રતિબંધિત તારીખ થી ૬૦ દિવસની અંદર પરત ચૂકવી દેવાનું જણાવ્યું હતું.

અનુ. નં.	બોરોઅર/કાયદેસરના વારસદાર (રો) અને કાયદેસરના પ્રતિનિધિ (ઓ)નાં નામ	તારીખના રોજ બાકી લેણાં રૂ.	ડિમાન્ડ નોટિસ તારીખ	પર્ગેશન તારીખ ફીઝિકલ/સિમ્બોલીક	સ્થાવર મિલકત(તો) / સલામત અસ્કયામત(તો) નું વર્ણન
(એ)	(બી)	(સી)	(ડી)	(ઈ)	(એક)
૧	શ્રી જુહાપુરા સુસુકા પાંચભાયા (બોરોઅર) શ્રીમતી દિલ્હીયા જુહાપુરા પાંચભાયા (કો-બોરોઅર) ૧૫૫૪૫૮-૬૪૬૬૬૪૩૦	રૂ. ૧૦,૬૩,૨૮૮/- રૂ. ૨૬,૫૪,૪૦૪/-	૨૨ માર્ચ, ૨૦૨૩	૨૬ ઓક્ટોબર, ૨૦૨૩	ફુલે-એ-બોર, સામો માળ, મહીના કોમ્પ્લેક્સ-૨, સ. નં. ૪૨/૨, તાજુ સરીયા પાસે, મહીના રેસિડન્સીની બાજુમાં, તાપી હોટેલ પાછળ, કાપોદરા રોડ, અંકલેશ્વર-૩૨૨૧૫૫.
૨	પત્ની/પુત્ર/પતિ/પુત્રી શ્રી કેસુરભાઈ મોહનભાઈ ગામીત (અવસાન પામેલ છે) અને અન્ય જાણમાં હોય/ જાણમાં ના હોય તેવા કાયદેસરના વારસદાર(રો), કાયદેસરના પ્રતિનિધિ(ઓ), અનુભાગીઓ અને અસાઈન્ડ-શ્રી કેસુરભાઈ મોહનભાઈ ગામીત (અવસાન પામેલ છે) (બોરોઅર) શ્રીમતી જયમતી કેસુરભાઈ ગામીત (કો-બોરોઅર) ૧૫૫૪૬૫-૬૫૨૧૪૪૮૫	રૂ. ૬,૫૪,૪૦૪/- રૂ. ૨૬,૫૪,૪૦૪/-	૨૨ માર્ચ, ૨૦૨૩	૨૬ ઓક્ટોબર, ૨૦૨૩	ફુલે-બી-૫૦૩, પાંચમો માળ, રાજપેલેસ સોપાઈન્ટ, ટાઈપ-બી, રે. સ. ૪૨/૫, સીએસ-૫૬૬૨, પ્લોટ-એ-૬૬, એ-૬૦, દુર્ગાન સોસાયટી પાસે, ગલાસ સર્કલ નજીક, કીમ રોડ, તરસાડી, સુરત-૩૬૪૧૨૦.
૩	શ્રી શરણ સિંઘ (બોરોઅર) ૧૫૫૪૬૫-૬૫૨૧૪૪૮૫ અને ૬૫૨૧૪૪૪૪	રૂ. ૮,૫૦,૯૫૬/- અને રૂ. ૨,૭૦,૯૫૬/- અનુક્રમે રૂ. ૨૬,૫૪,૪૦૪/- અને રૂ. ૨૬,૫૪,૪૦૪/-	૨૨ માર્ચ, ૨૦૨૩	૨૬ ઓક્ટોબર, ૨૦૨૩	સુનિલ-૨૫૫, રીવા રેસિડન્સી, રે. સ. ૬૪/૭/એ, ડે. પી. પાર્ક પાછળ, રેલવે લાઇન પાસે, ટર્નિંગ તરસાડી પોર્ટન્ટ, સુરત-૩૬૪૧૨૦.
૪	શ્રી અજય સિંઘ (બોરોઅર) ૧૫૫૪૬૫-૬૫૨૧૪૪૮૫ અને ૬૫૨૧૪૪૪૪	રૂ. ૪૫,૫૬૨/- અને રૂ. ૭,૩૬,૬૬૬/- અનુક્રમે રૂ. ૨૬,૫૪,૪૦૪/- અને રૂ. ૨૬,૫૪,૪૦૪/-	૨૨ માર્ચ, ૨૦૨૩	૨૬ ઓક્ટોબર, ૨૦૨૩	રો-હાઉસ-બી-૫૬, સન સિટી, સ. નં. ૨૬૬/એ, ૨૬૬/બી, વોલક નં. ૨૫૩, ૨૫૪, ડાલાવોર દર્દા રોડ, કીમ, કોસંગા રોડ, કુમ્ભવાડા, સુરત-૩૬૪૧૨૦.
૫	શ્રી સુમિત સિંઘ (બોરોઅર) શ્રીમતી મુનેશી સુમિત સિંઘ (કો-બોરોઅર) ૧૫૫૪૬૫-૬૫૨૧૪૪૮૫ અને ૩૧ ઓક્ટો. ૨૦૨૨ ના રોજ	રૂ. ૩૪,૫૬૬/- અને રૂ. ૧૨,૬૬૬,૫૩૦/- અનુક્રમે ૩૧ ઓક્ટો. ૨૦૨૨ ના રોજ	૨૬ નવે., ૨૦૨૨	૨૬ ઓક્ટોબર, ૨૦૨૩	રો-હાઉસ-૦૨, કાવ્યા રેસિડન્સી વિભાગ-બી, સ. નં. ૨૩૨/૧, ૨૩૨/૨, ૨૩૩/૧, ૨૩૩/૨, ૨૩૩/૩, ૨૩૩/૪, ૨૩૩/૫, ૨૩૩/૬, ૨૩૩/૭, ૨૩૩/૮, ૨૩૩/૯, ૨૩૩/૧૦, ૨૩૩/૧૧, ૨૩૩/૧૨, ૨૩૩/૧૩, ૨૩૩/૧૪, ૨૩૩/૧૫, ૨૩૩/૧૬, ૨૩૩/૧૭, ૨૩૩/૧૮, ૨૩૩/૧૯, ૨૩૩/૨૦, ૨૩૩/૨૧, ૨૩૩/૨૨, ૨૩૩/૨૩, ૨૩૩/૨૪, ૨૩૩/૨૫, ૨૩૩/૨૬, ૨૩૩/૨૭, ૨૩૩/૨૮, ૨૩૩/૨૯, ૨૩૩/૩૦, ૨૩૩/૩૧, ૨૩૩/૩૨, ૨૩૩/૩૩, ૨૩૩/૩૪, ૨૩૩/૩૫, ૨૩૩/૩૬, ૨૩૩/૩૭, ૨૩૩/૩૮, ૨૩૩/૩૯, ૨૩૩/૪૦, ૨૩૩/૪૧, ૨૩૩/૪૨, ૨૩૩/૪૩, ૨૩૩/૪૪, ૨૩૩/૪૫, ૨૩૩/૪૬, ૨૩૩/૪૭, ૨૩૩/૪૮, ૨૩૩/૪૯, ૨૩૩/૫૦, ૨૩૩/૫૧, ૨૩૩/૫૨, ૨૩૩/૫૩, ૨૩૩/૫૪, ૨૩૩/૫૫, ૨૩૩/૫૬, ૨૩૩/૫૭, ૨૩૩/૫૮, ૨૩૩/૫૯, ૨૩૩/૬૦, ૨૩૩/૬૧, ૨૩૩/૬૨, ૨૩૩/૬૩, ૨૩૩/૬૪, ૨૩૩/૬૫, ૨૩૩/૬૬, ૨૩૩/૬૭, ૨૩૩/૬૮, ૨૩૩/૬૯, ૨૩૩/૭૦, ૨૩૩/૭૧, ૨૩૩/૭૨, ૨૩૩/૭૩, ૨૩૩/૭૪, ૨૩૩/૭૫, ૨૩૩/૭૬, ૨૩૩/૭૭, ૨૩૩/૭૮, ૨૩૩/૭૯, ૨૩૩/૮૦, ૨૩૩/૮૧, ૨૩૩/૮૨, ૨૩૩/૮૩, ૨૩૩/૮૪, ૨૩૩/૮૫, ૨૩૩/૮૬, ૨૩૩/૮૭, ૨૩૩/૮૮, ૨૩૩/૮૯, ૨૩૩/૯૦, ૨૩૩/૯૧, ૨૩૩/૯૨, ૨૩૩/૯૩, ૨૩૩/૯૪, ૨૩૩/૯૫, ૨૩૩/૯૬, ૨૩૩/૯૭, ૨૩૩/૯૮, ૨૩૩/૯૯, ૨૩૩/૧૦૦, ૨૩૩/૧૦૧, ૨૩૩/૧૦૨, ૨૩૩/૧૦૩, ૨૩૩/૧૦૪, ૨૩૩/૧૦૫, ૨૩૩/૧૦૬, ૨૩૩/૧૦૭, ૨૩૩/૧૦૮, ૨૩૩/૧૦૯, ૨૩૩/૧૧૦, ૨૩૩/૧૧૧, ૨૩૩/૧૧૨, ૨૩૩/૧૧૩, ૨૩૩/૧૧૪, ૨૩૩/૧૧૫, ૨૩૩/૧૧૬, ૨૩૩/૧૧૭, ૨૩૩/૧૧૮, ૨૩૩/૧૧૯, ૨૩૩/૧૨૦, ૨૩૩/૧૨૧, ૨૩૩/૧૨૨, ૨૩૩/૧૨૩, ૨૩૩/૧૨૪, ૨૩૩/૧૨૫, ૨૩૩/૧૨૬, ૨૩૩/૧૨૭, ૨૩૩/૧૨૮, ૨૩૩/૧૨૯, ૨૩૩/૧૩૦, ૨૩૩/૧૩૧, ૨૩૩/૧૩૨, ૨૩૩/૧૩૩, ૨૩૩/૧૩૪, ૨૩૩/૧૩૫, ૨૩૩/૧૩૬, ૨૩૩/૧૩૭, ૨૩૩/૧૩૮, ૨૩૩/૧૩૯, ૨૩૩/૧૪૦, ૨૩૩/૧૪૧, ૨૩૩/૧૪૨, ૨૩૩/૧૪૩, ૨૩૩/૧૪૪, ૨૩૩/૧૪૫, ૨૩૩/૧૪૬, ૨૩૩/૧૪૭, ૨૩૩/૧૪૮, ૨૩૩/૧૪૯, ૨૩૩/૧૫૦, ૨૩૩/૧૫૧, ૨૩૩/૧૫૨, ૨૩૩/૧૫૩, ૨૩૩/૧૫૪, ૨૩૩/૧૫૫, ૨૩૩/૧૫૬, ૨૩૩/૧૫૭, ૨૩૩/૧૫૮, ૨૩૩/૧૫૯, ૨૩૩/૧૬૦, ૨૩૩/૧૬૧, ૨૩૩/૧૬૨, ૨૩૩/૧૬૩, ૨૩૩/૧૬૪, ૨૩૩/૧૬૫, ૨૩૩/૧૬૬, ૨૩૩/૧૬૭, ૨૩૩/૧૬૮, ૨૩૩/૧૬૯, ૨૩૩/૧૭૦, ૨૩૩/૧૭૧, ૨૩૩/૧૭૨, ૨૩૩/૧૭૩, ૨૩૩/૧૭૪, ૨૩૩/૧૭૫, ૨૩૩/૧૭૬, ૨૩૩/૧૭૭, ૨૩૩/૧૭૮, ૨૩૩/૧૭૯, ૨૩૩/૧૮૦, ૨૩૩/૧૮૧, ૨૩૩/૧૮૨, ૨૩૩/૧૮૩, ૨૩૩/૧૮૪, ૨૩૩/૧૮૫, ૨૩૩/૧૮૬, ૨૩૩/૧૮૭, ૨૩૩/૧૮૮, ૨૩૩/૧૮૯, ૨૩૩/૧૯૦, ૨૩૩/૧૯૧, ૨૩૩/૧૯૨, ૨૩૩/૧૯૩, ૨૩૩/૧૯૪, ૨૩૩/૧૯૫, ૨૩૩/૧૯૬, ૨૩૩/૧૯૭, ૨૩૩/૧૯૮, ૨૩૩/૧૯૯, ૨૩૩/૨૦૦, ૨૩૩/૨૦૧, ૨૩૩/૨૦૨, ૨૩૩/૨૦૩, ૨૩૩/૨૦૪, ૨૩૩/૨૦૫, ૨૩૩/૨૦૬, ૨૩૩/૨૦૭, ૨૩૩/૨૦૮, ૨૩૩/૨૦૯, ૨૩૩/૨૧૦, ૨૩૩/૨૧૧, ૨૩૩/૨૧૨, ૨૩૩/૨૧

यूको बैंक UCO BANK
(A Govt. of India Undertaking)
Head Office - II, Department of Information Technology
3 & 4, DD Block, Sector - 1, Salt Lake, Kolkata-700064

NOTICE INVITING TENDER
UCO Bank invites bid for Selection of System Integrator on account of CBS version Migration for Overseas Operation through GeM portal.
For any details, please refer to <https://www.ucobank.com> or <https://gem.gov.in>
(Deputy General Manager)
Date: 31.10.2023 Department of Information Technology

समान आपके विश्वास का | Honours Your Trust

XMSE METROPOLITAN STOCK EXCHANGE OF INDIA LIMITED
Registered Office: 205(A), 2nd floor, Piramal Agastya Corporate Park Kamani Junction, LBS Road, Kurla (West), Mumbai - 400070 Tel. 91 22 6112 9000.
Website: www.mse.in / Email id: secretarial@mse.in
Corporate Identity Number (CIN): U65999MH2008PLC185856

NOTICE FOR REGISTRATION OF E-MAIL ADDRESS BY THE EQUITY SHAREHOLDERS OF METROPOLITAN STOCK EXCHANGE OF INDIA LIMITED FOR THE UPCOMING NATIONAL COMPANY LAW TRIBUNAL ("NCLT") CONVENED MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING (VC)/ OTHER AUDIO VISUAL MEANS (OAVM)

Members may please note that the NCLT convened meeting of equity shareholders of Metropolitan Stock Exchange of India Limited will be held on Thursday, December 07, 2023 at 11.00 A.M. (IST) through VC/OAVM in compliance with order dated 18th October 2023 ("Tribunal Order"), in Company Application No. C.A.(CAA)/86/(MB)/2023 filed with the Hon'ble NCLT for sanctioning the Composite Scheme of Arrangement between Metropolitan Stock Exchange of India Limited ("MSE" or "Amalgamated Company") and MSE Enterprises Limited ("MEL" or "Amalgamating Company") and their respective Shareholders.

In compliance with all the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and the Rules made thereunder read with the MCA General Circular No. 14/2020 dated 8th April 2020, the Notice of NCLT convened Meeting of Equity Shareholders along with Explanatory Statement shall be sent to the shareholders by email on such email addresses which are registered with the Company. The Notice along with Explanatory Statement will also be available on the website of the Company at www.mse.in and on the website of National Securities Depository Limited ("NSDL") at <https://www.evoting.nsdl.com> (remote e-voting service provider agency).

Members who have not yet registered/ updated email addresses with the Company are requested to contact the Company at secretarial@mse.in or Telephone No. +91 22 6112 9000 and update their email ids.

This notice is being issued for the information and benefit of all the members of the Company and is in compliance with the applicable circulars/ notifications/ orders of the Ministry of Corporate Affairs.

For Metropolitan Stock Exchange of India Limited
Sd/-
Durgesh Kadam
Head - Legal and Company Secretary
Date: October 31, 2023 Membership No. F8496

भारतीय कंटेनर निगम लिमिटेड
Container Corporation of India Ltd.
(A Govt. of India Undertaking)
(आयुक्त संघ का उद्योग) (A Govt. of India Undertaking)

EOI No: CON/AREA-IV/WAREHOUSE MAJERHAT/CTKR/2023-24/01

Name of Work: ONLINE EOI FOR RENTING OUT WAREHOUSE SPACE AROUND 1500 SQ.MTR AT CONCOR WAREHOUSE FACILITY, CTKR, MAJERHAT, KOLKATA, ON MONTHLY RENTAL BASIS FOR A PERIOD OF 3+2 YEAR THROUGH AUCTION.

Estimated Cost: Rs.2,38,95,000/-including GST for period of 3+2 year

Period of Contract: 3+2 year

Earnest Money Deposit: Rs.4,77,900/- (through e-payment)

Cost of EOI Document (Non-refundable): Rs.1000/- through e-payment

EOI Processing Fee (Non-refundable): Rs.4720/- inclusive of all taxes through e-payment

Date of sale of EOI documents (online): From 01.11.2023 15:00 hrs. to 23.11.2023 (upto 16:00 hrs.)

Last Date & Time of submission of EOI: On or before 28.11.2023 upto 15:00 hrs

Date & Time of Opening of EOI: 29.11.2023 at 15:30 Hrs.

Note: Corrigendum/ Addendum/ Amendments/ Clarifications etc., if any, shall be hosted on our website only (www.concorindia.co.in). Bidders are requested to visit the website regularly. Contact CONCOR's AREA IV office, New Delhi / Cluster office, Kolkata for any doubt/ clarifications. CONCOR reserves the right to cancel / reject any or all the tenders at any time without assigning any reason thereof. For complete details log on to www.tenderwizard.com/ccil.

Signed Area Head-Area-IV

Technocraft Industries (India) Limited
Regd. Office: Technocraft House, A-25, Road No. 3, MIDC Industrial Estate, Andheri (E), Mumbai - 400093
Tel: 4098 2222; Fax No. 2836 7037; CIN: L28120MH1992PLC069252
Email: investor@technocraftgroup.com,
website: www.technocraftgroup.com

NOTICE
Pursuant to Regulation 29 (1) (a) read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a Meeting of the Board of Directors of the Company will be held on Friday, November 10, 2023, inter alia to consider and approve the Un-Audited Standalone & Consolidated Financial Results for the quarter ended September 30, 2023.

This intimation is also available on the website of the Company at www.technocraftgroup.com and on the websites of the Stock Exchanges where the shares of the Company listed at www.bseindia.com and www.nseindia.com.

For Technocraft Industries (India) Limited
Sd/-
Neeraj Rai
Company Secretary
Place: Mumbai
Date: October 30, 2023

The Supreme Industries Limited
CIN : L35920MH1942PLC003554
People who know plastics best
Regd. Office : 612, Raheja Chambers, Nariman Point, Mumbai - 400021 | Website : www.supreme.co.in
E-mail : investor@supreme.co.in | Tel. 91 22 62570000

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Half year ended 30th September 2023
(Regulation 47(1)(b) of the SEBI (LODR) Regulations, 2015) (Rs. in Crores)

Particulars	Quarter ended			Half year ended		Year ended
	30.09.2023 (Unaudited)	30.06.2023 (Unaudited)	30.09.2022 (Unaudited)	30.09.2023 (Unaudited)	30.09.2022 (Unaudited)	31.03.2023 (Audited)
Total Income	2321.38	2382.78	2092.12	4704.16	4302.65	9231.36
Net Profit before tax	319.48	283.37	105.16	602.85	373.31	1111.29
Net Profit after tax	243.19	215.54	82.02	458.73	295.87	865.33
Total Comprehensive income	242.45	214.79	81.79	457.24	295.42	862.42
Earning per Share - Basic & Diluted (Rs.)	19.14	16.97	6.46	36.11	23.29	68.12

Notes:

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Results are available on the Stock Exchange websites www.nseindia.com and www.bseindia.com and on the Company's website www.supreme.co.in.
- "Pursuant to The Business Transfer Agreement entered into with M/S. Parvati Agro Plast (a proprietorship entity), the Company has acquired its pipe manufacturing Unit situated at Sangli (Maharashtra) on a going concern basis, effective 17th October, 2023 at an aggregate consideration of Rs.151.38 Crores. Additionally, the Company has agreed to purchase adjoining Land to the aforesaid project at an aggregate consideration of Rs. 21 Crores, whose acquisition process will be completed in due course."
- The Board of Directors has declared the interim dividend @ 400 % i.e. Rs. 8 per share of Rs. 2 each (FV), for the financial year 2023-24. The Dividend will be paid to those shareholders whose names stand on the Register of Members as on the Record date i.e. 7th November, 2023.

4 Key Standalone Financial Information :

Particulars	Quarter ended			Half year ended		Year ended
	30.09.2023 (Unaudited)	30.06.2023 (Unaudited)	30.09.2022 (Unaudited)	30.09.2023 (Unaudited)	30.09.2022 (Unaudited)	31.03.2023 (Audited)
Total Income	2361.88	2382.74	2132.61	4744.62	4343.14	9283.35
Net Profit before tax	336.26	262.19	127.23	598.45	337.27	1010.43
Net Profit after tax	259.97	194.36	104.09	454.33	259.83	764.47
Total Comprehensive income	259.26	193.65	103.86	452.91	259.38	761.69
Earning per Share - Basic & Diluted (Rs.)	20.47	15.30	8.19	35.77	20.45	60.18

5 The above financial results have been reviewed by the Audit Committee before being approved by the Board of Directors at their meetings held on 30th October, 2023.

For The Supreme Industries Ltd.,
Sd/-
B L Taparia
Chairman
(DIN No. 00112438)

Place: Mumbai
Dated: 30th October, 2023

FILATEX INDIA LIMITED
Regd Office : S.No.274, Demni Road, Dadra-396 193 (UT of Dadra & Nagar Haveli)
Corporate Identification Number (CIN)- L17119DN1990PLC000091

Extract of Statement of Unaudited Financial Results for the Quarter and Half Year ended September 30, 2023 (Rs. In Lakhs)

S. No.	PARTICULARS	Quarter Ended			Half Year Ended		Year ended
		30.09.2023 (Unaudited)	30.06.2023 (Unaudited)	30.09.2022 (Unaudited)	30.09.2023 (Unaudited)	30.09.2022 (Unaudited)	31.03.2023 (Audited)
1	Total income from operations	1,10,784	1,06,927	1,16,342	2,17,711	2,18,671	4,30,387
2	Net Profit for the period (before tax, exceptional and/or extraordinary items)	3,152	2,396	3,408	5,548	9,256	12,208
3	Net Profit for the period before tax (after exceptional and/or extraordinary items)	3,152	2,396	3,408	5,548	9,256	12,208
4	Net Profit for the period after tax (after exceptional and/or extraordinary items)	2,310	1,762	2,516	4,072	6,855	8,990
5	Total Comprehensive Income for the period [Comprising profit for the period (after tax) and other comprehensive income (after tax)]	2,319	1,769	2,508	4,088	6,839	9,014
6	Paid up Equity Share Capital (Face value of Rs. 1/- each)	4,439	4,439	4,430	4,439	4,430	4,430
7	Earnings Per Share (Face value of Rs. 1/- each) (Not Annualised)						
	Basic :	0.52	0.40	0.56	0.92	1.54	2.02
	Diluted :	0.52	0.40	0.56	0.92	1.54	2.02

Notes:

a) The above is an extract of the detailed format of results for Quarter and Half year ended September 30, 2023 filed with the stock exchanges under regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Yearly financial results are available on Company's Website www.filatex.com and on the website of the Stock Exchanges www.nseindia.com and www.bseindia.com.

b) The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on October 30, 2023 and have undergone "Limited Review" by the Statutory Auditor of the Company. The financial results have been prepared in accordance with Indian Accounting Standards (IND-AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 and relevant amendment rules thereafter.

On behalf of the Board of Directors
MADHU SUDHAN BHAGERIA
CHAIRMAN & MANAGING DIRECTOR
DIN : 00021934

Place : New Delhi
Dated : October 30, 2023

Tapir Constructions Limited
(CIN: U72000DL2014PLC267441)
Extract of Unaudited Financial Results for the quarter ended 30 September 2023 (₹ in Millions)

Sl. No.	Particulars	Quarter ended	Corresponding	Previous year
		30 Sept. 2023 (Unaudited)	30 Sept. 2022 (Unaudited)	31 March 2023 (Audited)
1	Total Income from Operations	12.5	3.1	21.8
2	Net (Loss) / Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(15.3)	(17.3)	(55.1)
3	Net (Loss) / Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(15.3)	(17.3)	(55.1)
4	Net (Loss) / Profit for the period after Tax, (after Exceptional and/or Extraordinary items)	(15.3)	(17.3)	(55.1)
5	Total Comprehensive Income for the period [Comprising (Loss) / Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(15.3)	(17.3)	(55.1)
6	Paid up Equity Share Capital	0.5	0.5	0.5
7	Reserves (excluding Revaluation Reserve)	(2,060.8)	(2,017.5)	(2,045.5)
8	Securities Premium Account	-	-	-
9	Net Worth	(2,060.30)	(2,017.00)	(2,045.00)
10	Paid up Debt Capital / Outstanding Debt	3,374.10	3,853.4	3,404.8
11	Outstanding redemption preference share	-	-	-
12	Debt Equity Ratio	(1.64)	(1.91)	(1.66)
13	Earnings per Share (EPS) (Face value Per Share ₹10 each)			
	-Basic (Amount in ₹)	(306.00)	(348.41)	(1,102.57)
	-Diluted (Amount in ₹)	(306.00)	(348.41)	(1,102.57)
14	Capital Redemption Reserve	-	-	-
15	Debenture Redemption Reserve	-	-	-
16	Debt Service Coverage Ratio	(0.16)	(2.12)	(0.09)
17	Interest Service Coverage Ratio	(0.20)	(2.12)	(0.41)
18	Current ratio (In times)	0.79	0.79	0.80
19	Total debts to total assets	0.71	0.84	0.75
20	Long term debt to working capital (In times)	(0.69)	(1.22)	(0.90)
21	Bad debt to account receivable ratio (In %)	-	-	-
22	Current liability ratio (In times)	0.88	0.88	0.85
23	Debtor turnover ratio (In times)	-	-	-
24	Inventory turnover ratio (In times)	-	-	-
25	Operating margin (In %)	9.52	1.85	5.44
26	Net profit margin (In %)	(122.64)	(573.11)	(252.69)

Notes:

1 The above results have been reviewed and approved by the Board of Directors ("the Board") at its meeting held on 30 October 2023.

2 The above is an extract of the detailed format of Quarterly / Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 52(8), read with 52(4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Annual Financial Results are available on the Company's website (<https://indiabullsrealstate.com/tcl/>) and on the website of BSE (<https://www.bseindia.com>) and NSE (<https://www.nseindia.com>).

Registered Office: For and on behalf of the Board of Directors
Office No. 202, 2nd Floor, A-18, Rama House, Middle Circle, Connaught Place, New Delhi- 110 001.

Place : Mumbai
Date : 30 October 2023
Sameer Khanna
Whole-time director

Notice is hereby given that the share certificate(s) for the under mentioned equity shares of Grasim Industries Limited has/have been lost / misplaced/stolen and I/we are applying to the Company for issue duplicate share certificate(s).
Any person(s) who has/have a claim in respect of the said equity shares should lodge the same with the Company at its Corporate Office at Grasim Industries Limited, Aditya Birla Centre, 'A' Wing, 2nd Floor, S. K. Ahire Marg, Worli, Mumbai - 400 030, Maharashtra within 15 days from this date, else the Company will proceed to issue duplicate certificate(s) to the holder/claimant without any further intimation and no further claim would be entertained from any person(s).

Sr. No.	Folio Nos.	Name of the Shareholders	No. of Shares (Rs.2/-f.v.)	Certificate No.	Distinctive Nos. From To
1	Y10310	Yeshwant Ganesh Dike Jointly Mangala Yeshwant Dike	195	3108532	446820721 446820915
2	106505	Yeshwant Ganesh Dike Jointly Mangala Yeshwant Dike	370	3108122	446688226 446688595

Place: Mumbai Prachi Prabhakar Kulkarni
Date: 30-10-2023 (Applicant)

GREENPLY INDUSTRIES LIMITED
CIN: L20211AS1990PLC003484
Registered Office: Makum Road, P.O. Tinsukia, Assam-786125
Corporate Office: "Madgul Lounge", 23 Chetia Central Road, 5th & 6th Floor, Kolkata - 700 027
Phone: (033) 3051-5000, Fax: (033) 3051-5010,
Email: investors@greenply.com, Website: www.greenply.com

NOTICE

Notice is hereby given pursuant to Regulation 29 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of Greenply Industries Limited will be held on Monday, the 6th November, 2023, inter alia, to consider, approve and take on record the Un-audited financial results of the Company for the quarter and half year ended on 30th September, 2023.

This is to inform that, pursuant to the provisions of the SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015 (PIT Regulations) and Company's Code of Conduct for Prohibition of Insider Trading, the Trading Window for dealing in shares of the Company has already been closed with effect from 1st October, 2023 and will be reopened on 8th November, 2023 after expiry of 48 hours of submitting the above referred Financial Results of the Company to the Stock Exchanges on 6th November, 2023.

The said Notice may be accessed on the Company's website at <http://www.greenply.com/investors> and may also be accessed on the Stock Exchange websites at <http://www.bseindia.com> and <https://www.nseindia.com>

For Greenply Industries Limited
Sd/-
Kaushal Kumar Agarwal
Place: Kolkata
Date: 30th October, 2023 Company Secretary & Vice President-Legal

Ramco Systems Limited
Registered Office : 47, PSK Nagar, Rajapalayam - 626 108.
Corporate Office : 64, Sardar Patel Road, Taramani, Chennai - 600 113.
CIN: L72300TN1997PLC037550 E-mail: investorrelations@ramco.com www.ramco.com

Extract of Consolidated Financial Results for the Quarter & Half Year Ended September 30, 2023

Particulars	Unaudited for the Quarter Ended						Unaudited for the Half Year Ended				Audited for the Year Ended		
	September 30, 2023		June 30, 2023		September 30, 2022		September 30, 2023		September 30, 2022		March 31, 2023		
	Rs. Min.	USD Min.	Rs. Min.	USD Min.	Rs. Min.	USD Min.	Rs. Min.	USD Min.	Rs. Min.	USD Min.	Rs. Min.	USD Min.	
1 Total income from operations	1,287.32	15.71	1,399.42	17.13	1,197.76	15.14	2,686.74	32.83	2,407.23	30.97	4,977.32	62.48	
2 Net profit / (loss) for the period (before tax, exceptional items)	(1,477.34)	(18.05)	(483.03)	(5.91)	(619.37)	(7.85)	(1,960.37)	(23.96)	(1,122.78)	(14.45)	(2,206.75)	(27.70)	
3 Net profit / (loss) for the period before tax (after exceptional items)	(1,477.34)	(18.05)	(483.03)	(5.91)	(619.37)	(7.85)	(1,960.37)	(23.96)	(1,122.78)	(14.45)	(2,206.75)	(27.70)	
4 Net profit / (loss) for the period after tax (after exceptional items)	(1,457.57)	(17.80)	(468.04)	(5.73)	(604.31)	(7.66)	(1,925.61)	(23.53)	(1,111.58)	(14.30)	(2,068.59)	(25.97)	
5 Total comprehensive income for the period (comprising profit / (loss) for the period (after tax) and other comprehensive income (after tax))	(1,438.21)	(18.01)	(420.34)	(5.08)	(535.03)	(8.35)	(1,858.55)	(23.09)	(952.13)	(17.35)	(1,976.01)	(30.33)	
6 Equity share capital (face value of Rs.10 each)	353.39	6.63	352.75	6.62	308.51	6.08	353.39	6.63	308.51	6.08	352.63	6.62	
7 Reserves (excluding revaluation reserve) as shown in the Balance Sheet							3,222.87	36.75	4,606.21	54.45	4,978.79	58.59	
8 Earnings per share for the period (before and after extraordinary items) of Rs.10 each, in Rs. and USD: (Annulsed only for yearly figures)													
	Basic	(41.35)	(0.51)	(13.27)	(0.16)	(19.57)	(0.25)	(54.61)	(0.67)	(36.02)	(0.46)	(65.60)	(0.82)
	Diluted	(41.35)	(0.51)	(13.27)	(0.								